

# CLASSIC FILAMENTS LIMITED

CIN L17114GJ1990PLC013667

RegdOffice : Plot No.1, Priyanka House, Umiyadham Road, Varachha, Surat-395006.  
Tel :0261-2540570 email: [classicfilaments@ymail.com](mailto:classicfilaments@ymail.com), Website: [www.classicfilamentsltd.com](http://www.classicfilamentsltd.com)

**Date: 04/08/2023**

To,  
Dept. of Corporate Services  
BSE Limited  
PhirozeJeejeebhoy Towers  
Dalal Street  
Mumbai 400001

**Dear Sir,**

**Ref: Stock Code - 540310 - CLASSIC FILAMENTS LIMITED**

**Sub: Newspaper Advertisement – Prior to Dispatch of Notice of 33<sup>rd</sup> AGM of the Company to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) on September 14, 2023**

Dear Sir,

With reference to the above subject, please find enclosed copies of the newspaper advertisement to be published Prior to Dispatch of Notice of 33<sup>rd</sup> AGM of the Company to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) on Thursday, 14<sup>th</sup> September, 2023, published on 4<sup>th</sup> August, 2023 in:

1. Financial Express (Gujarati),
2. Financial Express (English).

This is also hosted on the Company's website at [www.classicfilamentsltd.com](http://www.classicfilamentsltd.com)

Please take the same on your records.

Thanking you,

Yours Faithfully,

For **CLASSIC FILAMENTS LIMITED**

**Ankita P. Shroff**  
**Compliance Officer & Company Secretary**  
**Membership No.: 36425**  
**Address: Plot No. 1, Priyanka House, Umiyadham Road, Varachha, Surat-395006**

**Encl: As above**

### PUBLIC NOTICE

**TO WHOMSOEVER IT MAY CONCERN**

This is to inform the General Public that the following share certificate of Gujarat Borosil Limited merged with Borosil Renewables Limited having its Registered Office at 1101, Crescendo, G Block, Opp. MCA Club, Bandra Kurla Complex, Bandra (E), Mumbai 400051 registered in the name of the following Shareholder/s have been lost by the Shareholder.

Sr. No.	Name of the Shareholder/s	Folio No.	Certificate No.	Distinctive Number/s	No. of Shares
1.	Manav Kejriwal	01643631	00014554	0017181271 to 0017181370	100
2.	Manav Kejriwal	01643631	00015004	0017226271 to 0017226370	100
3.	Manav Kejriwal	01643631	00015005	0017226371 to 0017226470	100
4.	Manav Kejriwal	01643631	00015006	0017226471 to 0017226570	100
5.	Manav Kejriwal	01643631	00015007	0017226571 to 0017226670	100
6.	Manav Kejriwal	01643631	00015009	0017226671 to 0017226770	100
7.	Manav Kejriwal	01643631	00033730	0019098671 to 0019098770	100
8.	Manav Kejriwal	01643631	00035451	0019270971 to 0019271070	100
9.	Manav Kejriwal	01643631	00065385	0022264371 to 0022264470	100
10.	Manav Kejriwal	01643631	00074338	0023159671 to 0023159770	100
11.	Manav Kejriwal	01643631	00074970	0023222671 to 0023222770	100
12.	Manav Kejriwal	01643631	00091459	0024871771 to 0024871870	100
13.	Manav Kejriwal	01643631	00092188	0024944671 to 0024944770	100
14.	Manav Kejriwal	01643631	00092512	0024977071 to 0024977170	100
15.	Manav Kejriwal	01643631	00092513	0024977171 to 0024977270	100

The Public are hereby cautioned against purchasing or dealing in any way with the above referred share certificates.

Any person who has any claim in respect of the said share certificates should lodge such claim with the Company or its Registrar and Transfer Agents Universal Capital Securities Pvt. Ltd. 247 Park, C-101, 1st Floor, L. B. S. Marg, Vikrol (W) Mumbai-400083 TEL: 022 49186270 within 15 days of publication of this notice after which no claim will be entertained and the Company shall proceed to issue Duplicate Share Certificates.

Sd/-  
Ajay Kejriwal  
Place: Kolkata  
Date: 03.08.2023  
Executor of the Estate of the Deceased

### NOTICE OF LOSS OF SHARES OF HINDUSTAN UNILEVER LIMITED

(Formerly Hindustan Lever Limited)

Regd. Off. Hindustan Unilever Limited, Unilever House, B.D. Savant Marg, Chakala, Andheri (East), Mumbai - 400 099

Notice is hereby given that the following share certificates have been reported as lost / misplaced and the Company intends to issue duplicate certificates in lieu thereof, in due course.

Any person who has a valid claim on the said shares should lodge such claim with the Company at its Registered Office within 15 days hereof.

Name of the Holder	Folio No.	No. of Shares (Rs. 1/-)	Certificate No. (s)	Distinctive No. (s)
Mr. Jayantilal Rasanias	HLL	300	5266023	1152137311 - 1152137610
Mrs. Chandravandana Rasanias	2942123			

Place : Ahmedabad Date : 04-08-2023

### કલાસીક ફિલામેન્ટ્સ લીમિટેડ

રજી. ઓફિસ: પ્લોટ નં.૧, પ્રિયંકા હાઈસ, ઉમિયાવામ રોડ, વરાણા, સુરત-૩૬૫૦૦૬.

CIN L17114GJ1990PLC013667 | Tel : 0261-2540570

email: classiffilaments@gmail.com, Website: www.classiffilamentsltd.com

**નોટીસ**

આ તમને જણાવવા માટે છે કે, કલાસીક ફિલામેન્ટ્સ લિમિટેડ (કંપની) ની ૩૩મી વાર્ષિક સામાન્ય સભા (AGM/મીટિંગ) વિડિઓ કોન્ફરન્સ (VC) / અન્ય ઓફિસો વિઝ્યુઅલ માધ્યમો (OAVM) દ્વારા ઓલાવવામાં આવશે. કંપની અધિનિયમ, 2013 ની તમામ લાગુ જોગવાઈઓ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) (લિસ્ટિંગ ઓફિસિયલ એન્ડ ડિસ્ક્લોઝર રિગ્યુલેશન્સ) રેગ્યુલેશન, 2015 (લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) હેઠળ બનાવેલા સંબંધિત નિયમોના પાલનમાં સમય સમય પર, 8 એપ્રિલ, 2020, 13 એપ્રિલ, 2020, 5 મે, 2020, 13 જુન-જુલાઈ, 2021, ડિસેમ્બર 14, 2021, 5 મે, 2022, 28 ડિસેમ્બર, 2022ના સામાન્ય પરિષદો અને અન્ય લાગુ પડતા પરિષદો સાથે વાંચો, જે કોઈપણ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સમયાંતરે જારી કરાયેલા (MCA પરિષદો) અને 12 મે, 2020, જાન્યુઆરી 15, 2021, મે 13, 2022, જાન્યુઆરી 5, 2023ના પરિષદો અને અન્ય લાગુ પડતા પરિષદો જો કોઈ કોઈય તો, જારી કરવામાં આવે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી પરિષદ) દ્વારા આ સંબંધે.

કંપનીના સભ્યોની ૩૩મી એજીએમ ગુજરાત, 14મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11.00 કલાકે (IST) યોજવામાં આવશે. એજીએમ ઓલાવતી સુધાના.

નાણાકીય વર્ષ 2022-23 માટે કંપનીના ૩૩મી વાર્ષિક અહેવાલની ઈ-કોપી સાથે એજીએમની સુધાના, નાણાકીય વિભાગ અને અન્ય વૈધાનિક અહેવાલો કંપનીની વેબસાઇટ [www.classiffilamentsltd.com](http://www.classiffilamentsltd.com) પર અને સ્ટોક એક્સ્ચેન્જની વેબસાઇટ [www.bseindia.com](http://www.bseindia.com) પર નિયત સમયે ઉપલબ્ધ રહેશે.

કંપનો ફક્ત VC/OAVM સુવિધા દ્વારા એજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે, જેની વિગતો કંપની મીટિંગની સુધાનામાં આપવામાં આવશે. તેનુસાર, કૃપા કરીને નોંધો કે ઉપરોક્ત પરિષદો પાલન સુનિશ્ચિત કરવા માટે કંપનીની ૩૩મી એજીએમમાં રૂબરૂ હાજર રહેવા અને તેમાં ભાગ લેવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. કંપની અધિનિયમ, 2013 ની કલમ 103 હેઠળ કોમ્પની ગણતરીના હેતુ માટે VC/OAVM દ્વારા મીટિંગમાં હાજર રહેવા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

વાર્ષિક અહેવાલ 2022-23 સાથે એજીએમની નોટિસ એવા સભ્યોને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવશે કે જેના ઈ-મેલ એક્સ કંપની / રજિસ્ટ્રાર અને ટ્રાસ્ટર અજ-રુસ (રજિસ્ટ્રાર) / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ (ડીપી) સાથે નોંધાયેલા છે. સેબીના પરિષદ મુજબ, એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલની ભૌતિક નકલો કોઈપણ સમયે મોકલવામાં આવશે નહીં. જે સભ્યોએ કૃપા સુધી તેમના ઈમેલ એક્સની નોંધણી કરાવી નથી તેઓને ઈ-વોટિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ મેળવવા માટે તેમના ઈમેલ એક્સની નોંધણી કરવા માટે નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરવા વિનંતી છે.

i) ભૌતિક શેરધરો માટે - કૃપા કરીને કોલિયો નંબર, શેરધરકાર નંબર, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), અધ્યાર (અધ્યાર કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કોપી) જેવી જરૂરી વિગતો મોકલવા દ્વારા [contact@skylinert.com](mailto:contact@skylinert.com) / [classiffilaments@gmail.com](mailto:classiffilaments@gmail.com) પર પ્રેરવાનું કરો.

ii) કોમ્પ્યુટર શેરધરો માટે - કૃપા કરીને કોમ્પ્યુટર માલની વિગતો (CDSL-16 અંકનો લાભધારી ID અથવા NSDL-16 અંકનો DPID + CLID), નામ, કલાકાર માસ્ટર અથવા કો-ઓર્ડિનેટર એક્સ-ટર સ્ટેટમેન્ટની કોપી, PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કોપી), AADHAAR (અધ્યાર કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કોપી) [contact@skylinert.com](mailto:contact@skylinert.com) / [classiffilaments@gmail.com](mailto:classiffilaments@gmail.com) પર પ્રેરવાનું કરો.

iii) કંપની / આરટીએ NSDL સાથે સંકળન કરશે અને ઉપરોક્ત શેરધરોને લોગિન ઓળખપત્રો પ્રદાન કરશે.

કલાસીક ફિલામેન્ટ્સ લિમિટેડ વતી  
સહી/-  
ભરત પટેલ  
અધ્યક્ષ અને સીએફઓ  
સંચાલક: સુરત  
તારીખ: ૦૩-૦૮-૨૦૨૩  
DIN- 00249234

### MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED

(સિક્યોરિટી ઇન્ડેક્સ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના કલમ ૮(૧) (સવાર મિલકત માટે અનુલ્લભ મિલકત માટે)

આથી, નીચે સૂચી કરનાર તે સાથે રૂબરૂ હાઈસિંગ અને મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ ના ઓથોરાઇઝ્ડ અધિકારીએ ધી સિક્યોરિટીઝ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ડેક્સ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨નો ઓર્ડર ૫૪) અને કાયદા તળેની સેક્શન ૧૩ (૧૨) સાથે ધી સિક્યોરિટી ઇન્ડેક્સ (એન્ફોર્સમેન્ટ) એક્ટ ૨૦૦૨ મુજબ મળેલ પાસવર્ડ સુજબ નીચે મુજબના કરજદાર / સહ-કરજદાર / જામીનદારને તા. ૨૧-૦૩-૨૦૨૩ના રોજ નોટિસ આપેલી અને તે નોટીસમાં જણાવેલ કલમ નોટીસ મુજબથી દિન-૯૦માં ચુકવવા જણાવેલ.

કરજદાર આ રકમ ચુકવવામાં અસમર્થ રહેલ છે, જેથી સહર કરજદાર / સહ-કરજદાર / જામીનદાર અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે સામાન્ય રીતે મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે થતા કોઈ પણ સોદાની તા. ૨૧-૦૩-૨૦૨૩ મુજબ લેણી થતા તેની પરના વ્યાજ ની રકમ માટે માસ રૂબરૂ હાઈસિંગ અને મોર્ગેજ ફાઇનાન્સ લિ. નાચાજમાં ગણાશે. અમો નીચે સૂચી કરનાર નીચે દર્શાવેલી મિલકતોનો તા. ૩૧-૦૭-૨૦૨૩ ના રોજ સાંકેતિક કલમો સેક્શન ૧૩ના સબસેક્શન (૪) સાથે રૂબ-૮ તળે મળેલ સત્તાની રૂબે મેળવેલ છે.

કરજદાર/સહ કરજદાર/જામીનદાર નું ધ્યાન દોરવામાં આવે છે કે, સહર કાયદાની કલમ ૧૩ની સબ-સેક્શન (૮) મુજબ સહર મિલકતની પુનઃ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ સમયમાં કલેઈમ કરી શકે છે.

કરજદાર/સહ કરજદાર/જામીનદારનાં નામ	સ્વાધર મિલકતનું વર્ણન	લોન એકાઉન્ટ નં પડોશભાગી તારીખ	બંધી નોંધણી વેબી સ્કેન (જે કિમક નોટિસમાં જણાવ્યા પ્રમાણે)
રાણુભાઈ નાનુભાઈ ચૌહાણ (અરજદાર)	જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ રાજકોટ ખાતે આવેલ યોજે મેડોશ, તા. લોખીકા, જીલ્લો. રાજકોટ ખાતે આવેલ રેવન્યુ સર્વે નં. ૧૮૪ પૈકી કે જે "અંજલી પાર્ક" ના નામથી ઓળખાય છે, પ્લોટ નં. ૫૧, ૫૨ કે જેનું કુલ ક્ષેત્રફળ ૬૧૦-૦૦ ચો.મી. છે તેના પર આવેલ મશીન આપાર્ટમેન્ટ ના નામે ઓળખાય છે. તેના ક્ષેત્રફળ નં. ૩૦૨, નીજો માળ, કે જેનું ક્ષેત્રફળ ૪૦.૬૪ ચો.મી. વજ વહેંચાયેલા જમીનના હક હિસ્સા સહીત તેવી બંધકામ સહીતની તમામ મિલકત	૦૧-૦૭-૨૦૨૩	તા. ૨૩-૦૩-૨૦૨૩ ના રોજ બાકી રૂ. ૧૩,૩૬,૫૨૧.૦૦ (અંકે રૂપિયા ત્રે લાખ ત્રણસાચાલીસ હજાર પાંચસો એકવીસ પુરા)

તારીખ : ૦૪-૦૮-૨૦૨૩  
સ્થાન : રાજકોટ  
અધિકૃત અધિકારી શ્રી ભરત પટેલ (સહી) ૦૨૫૧૬૬૦૯૮ વતી, માસ રૂબરૂ હાઈસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ

### HDFC BANK

એચડીએફસી બેંક લી., આકાશ કોમ્પ્લેક્સ, પહેલો માળ, જે. કે. હોલો સામે, ૧૦-વિજય વોટર કોર્નર, ગોંડલ રોડ, સુરત-૩૬૫૦૦૨.

સિક્યોરિટીઝ ઇન્ડેક્સ એક્ટ ૨૦૦૨ (સરકારી એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળની માંગણી નોટીસ.

૧. ઊંચાળા પ્રોસેસર - વતી તેના પ્રોમોટર સ્વ. કાંતિલાલ વમાલીલાસ માર્થક, મુલત વતી તેમના કાર્યદેસના વારસદારો દ્વારા નોટિસ પાડવામાં આવી

૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૨૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૩૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૪૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૫૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૬૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૭૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૮૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૧. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૨. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૩. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૪. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૫. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૬. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૭. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૮. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૯૯. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

૧૦૦. જુનેબાઈ કાંતિલાલ માર્થક C/o ઉર્વશી ડાર્શીન એન્ડ વર્સલ

### Sun Pharmaceutical Industries Limited

Regd Office: SPARC, Tandaj, Vadodara - 390012, Gujarat, INDIA

Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon (E), Mumbai - 400063

Tel No. +91 22 43244324 CIN: L24230GJ1993PLC019050 Website: www.sunpharma.com

**Extract of Unaudited Consolidated Financial Results for the Quarter ended June 30, 2023**

(₹ in Million)

Particulars	Quarter ended			Year ended
	30.06.2023 Unaudited	31.03.2023 Audited	30.06.2022 Unaudited	31.03.2023 Audited
Total revenue from operations	119,408.4	109,306.7	107,617.6	438,856.8
Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	28,040.1	24,111.4	22,848.4	95,798.8
Profit / (Loss) for the period before tax (after Exceptional items)	24,811.4	22,396.9	22,848.4	94,084.3
Net Profit / (loss) after taxes, share of profit / (loss) of associates and joint venture and non-controlling interests	20,225.4	19,844.7	20,608.8	84,735.8
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	22			

**CLASSIC FILAMENTS LIMITED**

Regd Office : Plot No.1, Priyanka House, Umiyadharm Road, Varachha, Surat-395006.

CIN L171146J1990PLC013667 | Tel: 0261-2540570

email: classicfilaments@gmail.com, Website: www.classicfilaments.com

**NOTICE**

This is to inform you that, the 33rd Annual General Meeting ('AGM'/Meeting) of Classic Filaments Limited (the 'Company') will be convened through Video Conference ('VC') / other audio visual means ('OAVM') in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the relevant Rules made there under and the Securities and Exchange Board of India (SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 (Listing Regulations), as amended from time to time, read with General Circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 14, 2021, May 5, 2022, December 28, 2022 and other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs from time to time ('MCA Circulars') and Circulars dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023 and other applicable circulars, if any, issued in this regard by the Securities and Exchange Board of India ('SEBI Circular').

The 33rd AGM of the Members of the Company will be held at 11.00 a.m. (IST) on Thursday, 14th September, 2023 through VC/OAVM facility provided by the National Securities Depository Limited ('NSDL') to transact the businesses as set out in the Notice convening the AGM.

The e-copy of 33rd Annual Report of the Company for the Financial Year 2022-23 along with the Notice of the AGM, Financial Statements and other Statutory Reports will be available on the website of the Company at www.classicfilaments.com and on Stock Exchange's website i.e. www.bseindia.com in due course of time.

Members can attend and participate in the AGM through VC/OAVM facility ONLY, the details of which will be provided by the Company in the Notice of the Meeting. Accordingly, please note that no provision has been made to attend and participate in the 33rd AGM of the Company in person to ensure compliance with the aforesaid Circulars. Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

The Notice of the AGM along with the Annual Report 2022-23 will be sent electronically to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Transfer Agents ('Registrar') / Depository Participants ('DPs'). As per the SEBI Circular, no physical copies of the Notice of AGM and Annual Report will be sent to any Member. Members who have not yet registered their email addresses are requested to follow the process mentioned below, for registering their email addresses to receive login ID and password for e-Voting:

i) For Physical Shareholders - please provide necessary details like Folio No., Name of Shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAAR (self attested scanned copy of Aadhaar Card) by email to contact@skylineta.com / classicfilaments@gmail.com.

ii) For Demat Shareholders - please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID). Name, client master or copy of Consolidated Account statement, PAN (self attested scanned copy of PAN card), AADHAAR (self attested scanned copy of Aadhaar Card) to contact@skylineta.com/classicfilaments@gmail.com.

iii) The company/RTA shall co-ordinate with NSDL and provide the login credentials to the above mentioned Shareholders.

For CLASSIC FILAMENTS LIMITED

Sd/-  
**BHARAT PATEL**  
DIRECTOR & CFO  
DIN: 00249234

Place : SURAT  
Date : 03-08-2023



**IDBI BANK LIMITED - ADAJAN BRANCH**  
Anavil Arced, Beside Mega Bites Hotels,  
Honey Park Road, Adajan, Surat-395009, Gujarat

**NOTICE UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 (the SARFAESI Act)**

Name of the Borrower/s:	Name of the Mortgagor/s and Guarantor/s:
Shri. Pabu Singh Smt. Rupa Pabu Singh	Shri. Pabu Singh (Borrower & Mortgagor) Shri. Harishchandra Vishwakarma (Guarantor)

Notice is hereby given to the aforesaid Borrower(s) and Mortgagor that the aforesaid Borrower was sanctioned financial assistance of Rs.10,50,000 (Rupees Ten Lakh Fifty Thousand Only) by IDBI Bank Ltd. (IDBI Bank), by way of Home Loan for purchase of house. Pursuant to the sanction of the said financial assistance, necessary loan and security documents were executed by Shri. Pabu Singh (Borrower & Mortgagor) & Smt. Rupa Pabu Singh (Co-Borrower). The said financial assistance has been secured, inter alia, by mortgage by deposit of title deeds of the properties mentioned below. As the aforesaid Borrower has defaulted in repayment of the said financial assistance in terms of the Loan Agreement (s) dated 20-02-2017, the account of the Borrower has been classified as non-performing assets (NPA) in the books of IDBI Bank in terms of the guidelines issued by Reserve Bank of India (RBI) from time to time. In view of the defaults committed by the aforesaid Borrower, IDBI Bank, vide its letter bearing Ref. No.:Recall-05120238824745 dated 15-05-2023, has declared the financial assistance together with interest (reckoned up to 09-04-2023 in the account) and other moneys aggregating Rs. 8,15,502/- (Rupees Eight Lakh Fifteen Thousands Five Hundred Two Only) as on 30-04-2023, to have become immediately due and payable by the Borrower and called upon the Borrower to pay to IDBI Bank the said sums together with further interest thereon with effect from 10.04.2023 till payment or realization, at the contractual rate as stated in the said letter. As on May 31, 2023 an amount of Rs. 8,15,502/- (Rupees Eight Lakh Fifteen Thousands Five Hundred Two Only) is due and payable by Shri. Pabu Singh & Smt. Rupa Pabu Singh to IDBI Bank, along with further interest (interest reckoned up to 09-04-2023) thereon at the contractual rate till payment/ realization.

Necessary notice was issued/served by IDBI Bank under section 13(2) of the SARFAESI Act at the respective addresses of the Borrower(s) and Mortgagor by "Registered post with Acknowledgement Due". However, notice sent to Shri. Pabu Singh (Borrower & Mortgagor) & Smt. Rupa Pabu Singh was returned un-served with postal remark "Addressee left". In view of the aforesaid, this public notice is issued in compliance with Proviso to Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Please note that you shall not transfer or otherwise (other than in the ordinary course of your business) any of the Secured Assets, without prior written consent of IDBI Bank, failing which you shall be liable for an offence punishable under section 29 of the SARFAESI Act.

We invite your attention to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

In the circumstances, Borrower(s)/Guarantor(s) is, once again, requested to pay the aforesaid amount within sixty days from the date hereof falling which IDBI Bank, as a secured creditor shall be entitled to enforce its security interest, under the provisions of the SARFAESI Act as also under any other law as available to IDBI Bank for realising its dues.

**DETAILS OF THE PROPERTY**

Immovable property (Residential House) admeasuring of 44.59 sq. mtrs, situated at Plot No-75, (after KJP known as Block no-88B/75 admeasuring 44.22 sq mtrs), at Sai Deep Residency, Moje-Jolva, Taluka- Palsana Dist-Surat, Gujarat. Bearing Block no-88/B (amalgamated the block no-88, part, 101, 102). Dist-Surat, Gujarat.

Date: 04.08.2023 - Place: Surat Authorised Officer & Deputy General Manager-IDBI Bank Ltd



**IDBI BANK LIMITED- AMBADA BRANCH**  
Near Ambada Vasar Seva Sahakari Mandali Ltd. Office, and  
Bus Stand, Tal & Dist Navsari, Ambada-396469, Gujarat

**NOTICE UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 (the SARFAESI Act)**

Name of the Borrower/s:	Name of the Mortgagor/s and Guarantor/s:
Shri. Rajeshbhai Dhirubhai Gondaliya Smt. Kiranben Gondaliya	Shri. Rajeshbhai Dhirubhai Gondaliya Smt. Kiranben Gondaliya

Notice is hereby given to the aforesaid Borrower(s) and Mortgagor(s) that the aforesaid Borrower was sanctioned financial assistance of Rs.11,47,500 (Rupees Eleven Lakh Forty Seven Thousand Five Hundred Only) by IDBI Bank Ltd. (IDBI Bank), by way of Home Loan for purchase of house. Pursuant to the sanction of the said financial assistance, necessary loan and security documents were executed by Shri. Rajeshbhai Dhirubhai Gondaliya (Borrower & Mortgagor) & Smt. Kiranben Gondaliya (Co-Borrower & Mortgagor). The said financial assistance has been secured, inter alia, by mortgage by deposit of title deeds of the properties mentioned below. As the aforesaid Borrower has defaulted in repayment of the said financial assistance in terms of the Loan Agreement (s) dated 18-09-2018, the account of the Borrower has been classified as non-performing assets (NPA) in the books of IDBI Bank in terms of the guidelines issued by Reserve Bank of India (RBI) from time to time. In view of the defaults committed by the aforesaid Borrower, IDBI Bank, vide its letter bearing Ref. No.:Recall-1611202392957946 dated 07-06-2023, has declared the financial assistance together with interest (reckoned up to 09-05-2023 in the account) and other moneys aggregating Rs. 14,08,646.28 (Rupees Fourteen Lakh Eight Thousands Six Hundred Forty Six & Twenty Eight Paise Only) as on 31-05-2023, to have become immediately due and payable by the Borrower and called upon the Borrower to pay to IDBI Bank the said sums together with further interest thereon with effect from 10.05.2023 till payment or realization, at the contractual rate as stated in the said letter. As on June 30, 2023 an amount of aggregating Rs. 14,08,646.28 (Rupees Fourteen Lakh Eight Thousands Six Hundred Forty Six & Twenty Eight Paise Only) is due and payable by Shri. Rajeshbhai Dhirubhai Gondaliya & Smt. Kiranben Gondaliya to IDBI Bank, along with further interest (interest reckoned up to 09-05-2023) thereon at the contractual rate till payment/ realization.

Necessary notice was issued/served by IDBI Bank under section 13(2) of the SARFAESI Act at the respective addresses of the Borrower(s) and Mortgagor by "Registered post with Acknowledgement Due". However, notice sent to Shri. Rajeshbhai Dhirubhai Gondaliya (Borrower & Mortgagor) & Smt. Kiranben Gondaliya (Borrower & Mortgagor) was returned un-served with postal remark "No such Person at this address". In view of the aforesaid, this public notice is issued in compliance with Proviso to Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Please note that you shall not transfer or otherwise (other than in the ordinary course of your business) any of the Secured Assets, without prior written consent of IDBI Bank, failing which you shall be liable for an offence punishable under section 29 of the SARFAESI Act.

We invite your attention to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

In the circumstances, Borrower(s)/Guarantor(s) is, once again, requested to pay the aforesaid amount within sixty days from the date hereof falling which IDBI Bank, as a secured creditor shall be entitled to enforce its security interest, under the provisions of the SARFAESI Act as also under any other law as available to IDBI Bank for realising its dues.

**DETAILS OF THE PROPERTY**

Immovable property (Residential Flat) admeasuring an area of 45.07 sq.mtrs, situated at Flat No-202, 2nd Floor, "Galaxy Avenue" Building-A, situated at Plot no-5 to 8 and Plot no-43 to 46 of Om Residency, bearing R.S. no-139/2, Block no137 at Village-Kamrej, Sub-district-Kamrej, Dist-Surat, Gujarat.

Date: 04.08.2023 - Place: Ambada Authorised Officer & Deputy General Manager-IDBI Bank Ltd



**ARM Branch, 7th Floor, Gift One Building, Gift City, Gandhinagar-382355**

The undersigned as Authorized officer of CANARA BANK has taken over possession of the following property/ies under section 13(4) of the SARFAESI act, Public at large is informed that e-auction (under SARFAESI act, 2002) of the charged property/ies in the below mentioned cases for realization of bank dues will be held on "AS IS WHERE IS, AS IS WHAT IS AND WHATEVER THERE IS" BASIS Under Rule 9 (1) of Security Interest (Enforcement) Rules, 2002.

**E-AUCTION SALE NOTICE TO PUBLIC UNDER SARFAESI ACT, 2002**

**DETAILS FOR MEGA E-AUCTION ON 22.08.2023 (01:00 PM TO 03:00 PM) • LAST DATE OF EMD : 21.08.2023**

Sr. No.	NAME OF BORROWER/S / GUARANTOR/S / MORTGAGOR/S	OUTSTANDING (RS)	DETAILS OF SECURITY/IES / STATUS OF POSSESSION	RESERVE PRICE & EMD	ACCOUNT DETAILS & NAME, CONTACT DETAIL OF BRANCH	Sr. No.	NAME OF BORROWER/S / GUARANTOR/S / MORTGAGOR/S	OUTSTANDING (RS)	DETAILS OF SECURITY/IES / STATUS OF POSSESSION	RESERVE PRICE & EMD	ACCOUNT DETAILS & NAME, CONTACT DETAIL OF BRANCH
<b>PROPERTIES OF ARM BRANCH</b>											
1	M/s. Khushbu Vinyls Pvt. Ltd., 1 Mr. Ghanshyambhai J. Patel 2 Mrs. Kaminiben G. Patel 3 Mr. Jayantibhai J. Patel 4 Mrs. Daminiaben J. Patel 5 Mr. Manojkumar J. Patel 6 Ms. Subhadra Patel, and 7 Mrs. Snehdaxa Infrastructure Pvt. Ltd. (Formerly known as M/s Binita Nesvi Infra Pvt. Ltd.) (Guarantor/Mortgagor)	Rs. 52,67,32,241.06 as on 18.01.2022 plus further interest and other charges thereon due to Canara Bank + Rs. 54,74,04,597.60 as on Date plus further interest and other charges thereon due to Bank of India	All that piece or parcel of immovable property being Unit No. GS-28 on Ground Floor total admeasuring about 1678.91 sq.ft. i.e. 156.03 Sq Mtrs and FF-28/A on First Floor admeasuring about 2000 Sq fts 185.87 Sq Mtrs (Super Built Up) along with undivided share in land with all common facilities of scheme situated in the scheme known as "SHREE BALAJI ALFA BAZAR" situated at High Street-I & developed on Ground Floor admeasuring 17732 Sq Ft (Super Built-up) aggregating about 17674 sq ft (Super Built up) aggregating about 35406 sq ft (super Built up) with 35.75 % i.e 1042 sq mtrs undivided land of scheme known as High Street-I situated at village Kocharab, Law Garden, Ellisbridge, Ahmedabad, developed on non agriculture land bearing T.P.No.3/6, Final Plot No. 603 in registration District Sub District Ahmedabad : 4 (Paldi) in the name of M/s Snehdaxa Infrastructure Pvt. Ltd. (Formerly known as M/s Binita Nesvi Infra Pvt. Ltd.) Status of Possession : Physical Possession	RESERVE PRICE : Rs. 1,43,50,000.00 EMD : Rs. 14,35,000.00	ARM Branch Ph: 079 - 69027812 / 818 / 823 / 820 / 822 Mob : 8238091942 / 9033119700 / 8470037686 Email : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966	5	Mr. Jugal Kishore Chhaganlal Jhavar, Mrs. Sarita Devi Jugal Kishore Jhavar, Mr. Narayan Prasad Jhavar, Mrs. Bhanwari Devi Jhavar (Erstwhile Directors and Guarantors of M/s. Supreme India Impex Ltd.)	Decretal dues mentioned in Original Application No 357/2019 filed before Hon'ble DRT-II Ahmedabad Rs. 2,94,00,33,124.50 as on 03.12.2019 plus further interest mentioned in the decree and other charges thereon due to Consortium Banks - lead Bank - Canara Bank, Member Banks- Bank of India, Bank of Baroda (e-Dena Bank & e-Vijaya Bank & UCO Bank	All that Piece and Parcel of Immovable Property on lower Ground Floor of Kohinoor Textile Market of Kohinoor Textile Market Co-operative Society Ltd with proportionate undivided share admeasuring 3.68 Sq mtrs (each shops) in the land in the said building constructed on land bearing City Survey Ward No 3, Nondh No. 2157/C, 2157/A, 2157/B & 2158/A/2/A situated in the Salabatpura area of Taluka: Choryasi, Dist: Surat. Status of Possession : Physical Possession	RESERVE PRICE : Rs. 15,73,000.00 EMD : Rs. 1,57,500.00 RESERVE PRICE : Rs. 15,73,000.00 EMD : Rs. 1,57,500.00 RESERVE PRICE : Rs. 18,35,000.00 EMD : Rs. 1,83,500.00 RESERVE PRICE : Rs. 18,35,000.00 EMD : Rs. 1,83,500.00 RESERVE PRICE : Rs. 16,05,000.00 EMD : Rs. 1,60,500.00 RESERVE PRICE : Rs. 25,15,000.00 EMD : Rs. 2,51,500.00 RESERVE PRICE : Rs. 18,30,000.00 EMD : Rs. 1,83,000.00 RESERVE PRICE : Rs. 18,30,000.00 EMD : Rs. 1,83,000.00 RESERVE PRICE : Rs. 18,40,000.00 EMD : Rs. 1,84,000.00 RESERVE PRICE : Rs. 2,76,000.00 EMD : Rs. 27,600.00 RESERVE PRICE : Rs. 1,80,000.00 EMD : Rs. 1,80,000.00	ARM Branch Ph.: 079 - 69027812 / 818 / 823 / 820 / 822 Mob : 8238091942 / 9033119700 / 8470037686 Email : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966
2	M/s. Maitri Pole Manufacturer, Proprietor Mr. Vijaybhai Rasikbhai Anandariya (Borrower), Smt. Riddhiben Vijaybhai Anandariya (Guarantor /Mortgagor)	Rs. 1,27,36,115.18 in term loan together with further interest from 03.03.2021, Rs. 65,05,169.00 in working capital term loan as on 12.05.2021 together with further interest from 13.05.2021, Rs. 5,15,485.00 in funded interest term loan as on 02.07.2021 together with further interest from 03.07.2021 and Rs. 7,04,458.94 in funded interest term loan as on 02.07.2021 together with further interest from 03.07.2021 and other charges thereon	Block/Survey No. 919 paiki 2, N.A. Land bearing Block No. / Survey No. 919 admeasuring about 16795 sqr. mtrs. along with construction thereon, Village Sayla, Taluka Sayla, District Registration District-Surendranagar and Sub-district of surendranagar. Status of Possession : Symbolic Possession	RESERVE PRICE : Rs. 1,10,20,000.00 EMD : Rs. 11,02,000.00	ARM Branch Ph: 079 - 69027812 / 818 / 823 / 820 / 822 Mob : 8238091942 / 9033119700 / 8470037686 Email : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966	6	M/s. Century Venture, Shri Yogeshkumar Navaratan Todi (Partner / Guarantor), Smt. Manisha Yogeshkumar Todi (Partner/Guarantor)	Rs. 1,19,01,138.00 as on 31.05.2021 in cash credit, Rs. 5,90,35,949.42 in Term Loan as on 03.06.2021, Rs. 4,12,55,667.00 in Working Capital Term Loan as on 27.05.2021 and Rs. 6,60,458.00 in Covid funded interest term loan as on 31.05.2021 plus further interest and charges thereon	Hypothecated Machineries : 1. Three Color Flexo Printer Slitter Die- Cutter Machine with Stackler, Nantai Precise Machinery & Tech Ltd, Foshan, Model No.: NT1225B, Factory Date : 2016.07.04, Factory No.: N3-1225-16004 2. Folder/Flier/Stitch Machine, Godswill Paper Machinery Co. Ltd., Make Mode No. GS202N5, Series No. 1013254 Installed and located at Total Plot No. 71/A and 71/B admeasuring 5047.93 sq Mtrs (at site known as Plot No. 71) together with construction to be constructed thereon, in a scheme known as "Soham Integrated Textile Park" at Survey No. 384 of Mouje-Timba and Survey No. 192 Paiki of Mouje-Mahijda Paiki Village: Timba and Mahijda, Taluka: Dasroi, District: Registration District Ahmedabad and Sub-District of Ahmedabad-11 (Aslali). Status of Possession : Physical Possession	RESERVE PRICE : Rs. 31,50,000.00 for Both the Machineries together EMD : Rs. 3,15,000.00	ARM Branch Ph: 079 - 69027812 / 818 / 823 / 820 / 822 Mob : 8238091942 / 9033119700 / 8470037686 Email : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966
3	M/s. Century Venture, Shri Yogeshkumar Navaratan Todi (Partner / Guarantor), Smt. Manisha Yogeshkumar Todi (Partner/Guarantor)	Rs. 1,19,01,138.00 as on 31.05.2021 in cash credit, Rs. 5,90,35,949.42 in Term Loan as on 03.06.2021, Rs. 4,12,55,667.00 in Working Capital Term Loan as on 27.05.2021 and Rs. 6,60,458.00 in Covid funded interest term loan as on 31.05.2021 plus further interest and charges thereon	Hypothecated Machineries : 1. Three Color Flexo Printer Slitter Die- Cutter Machine with Stackler, Nantai Precise Machinery & Tech Ltd, Foshan, Model No.: NT1225B, Factory Date : 2016.07.04, Factory No.: N3-1225-16004 2. Folder/Flier/Stitch Machine, Godswill Paper Machinery Co. Ltd., Make Mode No. GS202N5, Series No. 1013254 Installed and located at Total Plot No. 71/A and 71/B admeasuring 5047.93 sq Mtrs (at site known as Plot No. 71) together with construction to be constructed thereon, in a scheme known as "Soham Integrated Textile Park" at Survey No. 384 of Mouje-Timba and Survey No. 192 Paiki of Mouje-Mahijda Paiki Village: Timba and Mahijda, Taluka: Dasroi, District: Registration District Ahmedabad and Sub-District of Ahmedabad-11 (Aslali). Status of Possession : Physical Possession	RESERVE PRICE : Rs. 31,50,000.00 for Both the Machineries together EMD : Rs. 3,15,000.00	ARM Branch Ph: 079 - 69027812 / 818 / 823 / 820 / 822 Mob : 8238091942 / 9033119700 / 8470037686 Email : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966	7	M/s. Sai Satya Enterprise Pvt. Ltd., (Directors: Mr. Purnendu Pani (Borrower / Guarantor /Mortgagor), Mrs. Nilima Pani (Borrower / Mortgagor / Guarantor), Mr. Anupam Pani (Guarantor)	Rs. 51,23,05,092.06 as on 30.04.2023 & further interest plus Charges thereon	Shop No. 402, 4th Floor, D R World Mall, Near AAI Mata Temple, Parvar Paliya, Surat (Mauje Dumbhal, RS No. 44/1/A, Block No. 54, TP No. 34 (Mauje-Dumbhal), FP No. 10/A paiki sub plot no. 5, 6 & 7 paiki) Area: 4565 Sq.ft. Status of Possession : Physical Possession	RESERVE PRICE : Rs. 90,73,000.00 EMD : Rs. 9,07,300.00	ARM Branch Ph: 079 - 69027812 / 818 / 823 / 820 / 822 Mob : 8238091942 / 9033119700 / 8470037686 Email : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966

**Other Terms and Conditions:** The sale shall be subject to the conditions prescribed in the Security Interest (Enforcement) Rules, 2002 and to the following conditions. (1) Auction will be held on 22.08.2023 from 01:00 pm to 03:00 pm (2) For all the properties The Auction Sale is conducted on "As is where is, As is what is and Whatever there is" Basis. Bank is not aware of any pending charges, taxes, etc. Purchasers are bound to verify the same and, if any, have to bare the same. (3) Auction / bidding shall be done only through "Online Electronic Bidding" through the website http://indianbankseaction.com. Bidders are advised to go through the website (www.canarabank.com) under link E-Auction for detailed terms before taking part in the E-Auction Sale proceedings (4) The Property can be inspected, with Prior Appointment with Authorized Officer, on 08.08.2023 (5) The Property will not be sold below the Reserve Price and the participating bidders may improve their offer during auction process. (6) EMD amount of 10% of the Reserve Price is to be deposited by way of Demand draft in favour of Authorized Officer Canara Bank, OR shall be deposited through RTGS/NEFT/Fund Transfer to credit of account of Canara Bank (Account details given for the concerned branches). (7) Intending bidders should hold a valid signature certificate and e-mail address. For details with regard to digital signature please contact the service provider M/s. Canbank Computer Services Ltd., No. 218, J P Royale, 1st Floor, Sampige Road, 2nd Main, Malleswaram, Bengaluru-560003; Email : eauction@ccsl.co.in, ccslseaction@gmail.com, Mr. Pratap Kanjilal & D.D. Pakhre, Contact : 9832952602 / 9911293517 / 8898418010 / 080-23469665 / 9480691777 Immediately on the same date payment of the EMD amount the bidders shall approach the said service provider for obtaining digital signature (If not holding a valid digital signature) (8) Last date for depositing the EMD is 21.08.2023 after payment of the EMD amount, the intending bidders should send a copy of the following documents/details on or before date of submission of the bid(s), to Canara Bank, Branch, concerned to the property. (A) Demand Draft/Pay order towards EMD amount if paid through RTGS/NEFT, acknowledgement receipt thereof with UTR No. (B) Photocopies of PAN Card, ID Proof and Address proof. However, successful bidder would have to produce these documents in original to the Bank at the time of making payment of balance amount of 25% of bid amount. (C) Bidders Name, Contact No., Address, E-mail (D) Bidders A/C. details for online refund of EMD. (9) Last Date for receipt of tender documents: 21.08.2023 (10) The intending bidders should register their names at portal http://indianbankseaction.com to get their User ID and password free of cost. Prospective bidder may avail online training on E-auction from the service provider M/s. Canbank Computer Services Ltd., No. 218, J P Royale, 1st Floor, Sampige Road, 2nd Main, Malleswaram, Bengaluru-560003; Email : eauction@ccsl.co.in, ccslseaction@gmail.com, Mr. Pratap Kanjilal & D.D. Pakhre, Contact : 9832952602 / 9911293517 / 8898418010 / 080-23469665 / 9480691777 (11) EMD deposited by the unsuccessful bidder shall be refunded to them within 7 days of finalization of sale. The EMD shall not carry any interest. (12) The bank will have the absolute right/discretion for acceptance/rejection of any bid and all bidders to initiate any legal action against the Bank from non-sale of such denied asset simply because such a bidder was successful/highest bidder. (13) Auction would commence at Reserve Price plus one increment of Rs. 10,000 and bidders shall improve their offers multiples of Rs. 10,000 (Rs. Ten Thousand), if required. The bidder who submits the highest bid (not below the Reserve Price on closure of "Online" auction shall be declared as successful bidder. Sale shall be confirmed in favour of the successful bidder, subject to confirmation of the same by the secured creditor. (14) The successful bidder shall deposit 25% of sale price (inclusive of EMD already paid) immediately on declaring him/her as the successful bidder and the balance within 15 days from the date of confirmation of sale by the successful creditor. If the successful bidder fails to pay the sale price within the period stated above, the deposit made by him/her shall be forfeited by the Authorized Officer without any notice and property shall forthwith be put for sale again. Notwithstanding contained herein, the confirmation regarding successful bidder is subject to any suit filed to be filed or any other order by any competent authority/court/tribunal. (15) Where the sale consideration, of the property to be transferred is Rs. 50 Lakhs and above the successful bidder will have to deduct Tax Deducted at Source) TDS @ 1% on the sale proceeds and deposit the same by furnishing the Challan in form 260B and submit the original receipt of TDS certificate to the Bank (16) All charges for conveyance, stamp duty and registration charges etc., as applicable shall be borne by the successful bidder only. (17) Authorized Officer reserves the right to postpone/cancel or vary the terms and conditions of the e-auction without assigning any reason thereof. (18) In case there are bidders who do not have access to the internet but interested in participating the e-auction, they can approach Canara Bank, Circle Office, Gandhinagar or Concerned Branch of Canara Bank who as a facilitating center shall make necessary arrangements. (19) For further details Contact M/s. Canbank Computer Services Ltd., No. 218, J P Royale, 1st Floor, Sampige Road, 2nd Main, Malleswaram, Bengaluru-560003; Email eauction@ccsl.co.in, ccslseaction@gmail.com, Mr. Pratap Kanjilal & D.D. Pakhre, Contact : 9832952602 / 9911293517 / 8898418010 / 080-23469665 / 9480691777 (20) The bank is free to sale the property under private treaty or purchase as Non-Banking Assets, out of the above said properties, under the provision of the SARFAESI Act, in case no bidder is turning up for the purchase of property. No future notice shall be issued for the same. (21) To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on the properties. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrance, title of properties put on auction and claims/rights/dues/affecting the property, prior to submitting their bid. The e-auction advertisement does not constitute and will not be demand to constitute any commitment or any representation of the Banks. The property is being sold with all the existing and future encumbrance whether known or unknown to the Bank. Further some properties are available on symbolic possession and few are occupied by tenants/third parties as mentioned in the advertisement which may be noted. The Authorized Officer/Secured Creditors shall not be responsible in any way for any third party claims/rights/dues. (22) Where Factory land, building and Plant and Machinery both are put on auction for any borrower, EMD only for factory land and building will not be considered and sale will be confirmed after the plant machinery are sold out.

For detailed terms and conditions of sale, please refer to the link provided in <https://www.indianbankseaction.com> and <https://www.canarabank.com> Also, Prospective Bidders May Contact Respective Branch/Authorised Officer.

Date : 04.08.2023 | Place : Gandhinagar

Sd/- Authorised Officer, Canara Bank